

## રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબ ખાલી જગ્યા ભરવા માટે તા.૧૩/૦૬/૨૦૧૯, ગુરુવાર સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ક્રમ	જગ્યાનું નામ	કુલ જગ્યા	કક્ષાવાર જગ્યાઓ					કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ					કુલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્તતા માટે અનામત
			બિન અનામત (સામાન્ય)	આર્થિક રીતે નબળા વર્ગો	સા.શી.પ	અનુ. જાતી	અનુ. જન જાતી	બિન અનામત (સામાન્ય)	આર્થિક રીતે નબળા વર્ગો	સા.શી.પ	અનુ. જાતી	અનુ. જન જાતી	
૧	ક્લીનર કમ જુનીયર ફાયરમેન	૧૫	૦૦	૦૬	૦૨	૦૧	૦૬	૦૦	૦૨	૦૦	૦૦	૦૨	૦૦
	કુલ	૧૫	૦૦	૦૬	૦૨	૦૧	૦૬	૦૦	૦૨	૦૦	૦૦	૦૨	૦૦

ક્લીનર કમ જુનીયર ફાયરમેનની લાયકાત	<ul style="list-style-type: none"> <li>- ત્રણ ધોરણ પાસ,</li> <li>- રાજ્ય કક્ષાએ રમત-ગમત ક્ષેત્રે સારો દેખાવ કરનાર ઉમેદવારને મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.</li> </ul> <p><b>શારીરિક લાયકાત:</b></p> <ul style="list-style-type: none"> <li>- ઉચાઈ લઘુત્તમ ૫'૫"</li> <li>- વજન લઘુત્તમ ૫૦ કિલો</li> <li>- છાતી સામાન્ય ૩૨ ઇંચ છાતી કુલાવેલ ૩૪ ઇંચ</li> <li>- સ્વીમીંગ ડાઈવીંગની જાણકારી આવશ્યક છે.</li> </ul> <p>કોર્પોરેશનના કર્મચારીઓને વયમર્યાદાની લાયકાત લાગુ પડશે નહીં.</p>
પગારધોરણ અને વય મર્યાદા	<p>પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૧૯૯૫૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ સાતમાં પગારપંચ મુજબ રૂ.૧૮૦૦૦-૫૬૯૦૦ (લેવલ-૧) (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૫૨૦૦-૨૦૨૦૦ (ગ્રેડ પે-૧૮૦૦) વયમર્યાદા : ૧૮ થી ૩૦ વર્ષ</p>

આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવારને આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને પાંચ વર્ષની છૂટછાટ તથા પાંચ વર્ષ મહિલા અનામતના એમ કુલ ૧૦ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહિ.

૧. ઉક્ત જગ્યાઓ પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્ય કોઈ માધ્યમ મારફતે કરવામાં આવેલ અરજી રદબાતલ ગણવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ તથા તેને લગત વધુ વિગતો [www.rmc.gov.in](http://www.rmc.gov.in) પરથી મેળવી શકાશે.
૨. પ્રેક્ટિકલ ટેસ્ટની તારીખની જાણ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર જાણ કરવામાં આવશે.
૩. આરક્ષિત વર્ગના ઉમેદવારોએ રૂ.૫૦/- (પચાસ) તથા અન્ય ઉમેદવારોએ રૂ.૧૦૦/- (એકસો) ની પરીક્ષા ફી માત્ર અને માત્ર ઓનલાઈનથી જ જમા કરાવવાની રહેશે તેમજ સા.શી.પ.વર્ગના ઉમેદવારે ચાલુ નાણાંકીય વર્ષનું નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક:ઈ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૦૩/અ થી નિયત થયેલ નમૂના (અંગેજીમાં Annexure KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ) માં મેળવેલ પાત્રતા પ્રમાણપત્ર (અર્થાત તેઓ EWS Category હેઠળ આવે છે તે મતલબનું પ્રમાણપત્ર)ના નંબર અને તારીખ ઓન લાઈન અરજી કરતી વખતે દર્શાવવાની રહેશે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજૂ કરવાનું રહેશે. અન્યથા અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
૪. ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજી ફી રીફંડ થશે નહિ/પરત મળશે નહિ.
૫. અનામત વર્ગના ઉમેદવારો જો બિનઅનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહિ.
૬. અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ લાયકાત, અનુભવ અને ઉમરની ગણતરી કરવામાં આવશે.
૭. ઉમેદવારોની આવેલ અરજીની સંખ્યાને ધ્યાને લઈ નિમણૂક અધિકારી દ્વારા ઉમેદવારોના મેરીટ ક્રમાંક નિયત કરવા અંગેની ઉચિત કાર્યપ્રણાલી અનુસરીને પસંદગી કરવામાં આવશે.
૮. વધુ માહિતી માટે મહેકમ શાખા, બીજો માળ, રૂમ નં.-૧ નો સંપર્ક કરવો.
૯. રાજકોટ મહાનગરપાલિકાની ક્લીનર કમ જુનીયર ફાયરમેનની જગ્યા માટે જે પ્રેક્ટિકલ ટેસ્ટ નિયત કરવામાં આવે તેમાં ઉમેદવારે ઉત્તીર્ણ થવાનું રહેશે.

સહી:- બી.એન.પાની  
કમિશનર  
રાજકોટ મહાનગરપાલિકા